DN: email=mail@realpatidar.com
Date: 2017.01.17 13:15:38 +05'30'

realpatidar.com

પ. પૂ. સદગુરૂ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સંસ્થાપિત
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ (દ્વારા સંકલિત)

અ.નં.	વિગત	પહેલા કર્તાયુગમાં (સતયુગ)	બીજા ત્રેતાયુગ	ત્રીજા દ્વાપરયુગ	ચોથા કળીયુગ
૧	વેદ	ઋગ્વેદ	યજુર્વેદ	સામવેદ	અર્થવેદ
૨	જગતગુરુ	શ્રીઅમરતેજ	શ્રીવશિષ્ટઋષિ	શ્રીવેદવ્યાસ	શ્રીઈમામશાહ મહારાજ
૩	ભક્તનું નામ	શ્રીપ્રહલાદજી	શ્રીહરિચંદ્ર	શ્રીયુધિષ્ઠિર	શ્રીકંળાકુંવર
૪	દાનવનું નામ	શ્રીહરીણ્યકશિપુ	રાવણ	દુર્યોધન	દૈત્યકાલિંગો
૫	યજ્ઞનું નામ	હસ્તીમેઘ	અશ્વમેઘ	ગૌમેઘ	વારિયજ્ઞ
૬	આસન પટપાટ	સોનાના	રૂપાના	ત્રાંબાના	માટીના
૭	જાપ	શ્રીનરસિંહ	શ્રીરામ	શ્રીકૃષ્ણ	શ્રી નિષ્કલંકીનારાયણ જનાર્દનરાય
૮	વ્રતનું મહાત્મ્ય	સુદ૧૧ રવિવાર	સુદ ૧૪ મંગળવાર	સોમવતી અમાસ	સુદ ૨ શુક્રવાર
૯	પુજાનો પુજ્ય રંગ	રક્તવર્ણ	જરદવર્ણ	શ્યામવર્ણ	શ્વેતવર્ણ
10	દિશા	ઉત્તર	પૂર્વ	દક્ષિણ	પશ્ચિમ
૧૧	તીર્થ	૨૪ તીર્થ	૧૮ તીર્થ	૧૪ તીર્થ	૧૨ તીર્થ
૧૨	અવતાર	ચારઃશ્રીમત્સય, શ્રી કુર્મ, શ્રીવરાહ શ્રીનરસિંહ	ત્રણઃશ્રીવામન શ્રીપરશુરામ,શ્રીરામ	બે : શ્રીકૃષ્ણ શ્રીબુધ્ધ	એક : શ્રી નિષ્કલંકી
૧૩	વિષ્ણુની પરિવાર	૧૬ કરોડી	૩૨ કરોડી	૫૬ કરોડી	૭૦ કરોડી
૧૪	સ્થળ	કાશ્મીર	અયોધ્યા	ગોકુળ	કુંવારીકા : પીરાણા
૧૫	ક્ષેત્ર	ચરણાપુરી	લંકાપુરી	મથુરા	પંચનદી : [illegible]
૧૬	આયુધનું નામ	નખ	ધનુષ્ય	ચક્ર	તલવાર
૧૭	સતીઓના નામ	શ્રીબાઈ	શ્રીતારામતી	શ્રી દ્રૌપદી	શ્રી સુરજારાણી
૧૮	નદીઓના નામ	ગંગાજી	સરયુ	યમુનાજી	સાબરમતી
૧૯	મોક્ષપદ પામ્યા	૫ કરોડ	૭ કરોડ	૯ કરોડ	૧૨ કરોડ
૨૦	મનુષ્યના અવતારો	૩૫ અવતાર	૨૫ અવતાર	૧૬ અવતાર	૮ અવતાર
૨૧	મનુષ્યનું આયુષ્ય	૧,૨૦,૦૦૦ વર્ષ	૧૨,૦૦૦ વર્ષ	૧૨૦૦ વર્ષ	૧૨૦ વર્ષ
૨૨	દાગ	વાયુદાગ	જળદાગ	અગ્નિદાગ	ભૂમિદાગ

realpatidar.com

Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com